



ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ
૬ઠો માળ, ગિફ્ટ વન, રોડ ૫-સી, ઝોન-૫, ગિફ્ટસીટી, ગાંધીનગર, -૩૮૨૩૫૫
ગુજરાત: ઇ-મેઇલ : gerc@gernin.org , Web Site : www.gercin.org

જાહેર નોટિસ

નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટે એકંદરે વાર્ષિક મહેસૂલ જરૂરિયાત અને પ્રશુલ્ક નિર્ધારણ કરવા માટે ની અરજીને તૈયાર કરવા અને ફાઇલ કરવા પર સ્પષ્ટીકરણ અને માર્ગદર્શન કરવા માટેના આદેશનો મુસદ્દો.

નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ થી ૨૦૨૫-૨૦૨૬ ના નિયંત્રણ મુદત માટે નવા બહુ વર્ષીય પ્રશુલ્ક વિનિયમો બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, પરંતુ આયોગના નિયંત્રણ બહારના કારણોને લીધે તેનું આખરી રૂપમાં વિલંબ થયેલ છે. નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટે એકંદરે વાર્ષિક મહેસૂલ જરૂરિયાત અને પ્રશુલ્ક અરજીઓની તૈયારી માટે સ્પષ્ટતા/માર્ગદર્શન આપવા માટે યુટિલિટીઝ તરફથી નામદાર આયોગને વિનંતીઓ કરવામાં આવેલ છે.

આ સંદર્ભે, આયોગ દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટે એકંદરે વાર્ષિક મહેસૂલ જરૂરિયાત અને પ્રશુલ્ક નિર્ધારણ માટેની અરજીને ફાઇલ કરવા માટેનો આદેશનો મુસદ્દો તૈયાર કરવામાં આવેલ છે અને બહુ વર્ષીય પ્રશુલ્ક ફેમવર્ક માટે અગાઉ સૂચિત કરેલ ૨૦૨૧-૨૦૨૬ ના નિયંત્રણ મુદતને ૨૦૨૨-૨૦૨૭ ની મુદત માટે દરખાસ્ત કરેલ છે અને તમામ સંબંધિત પરવાનેદાર/યુટિલિટીઝને નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે ની પ્રશુલ્ક પીટીશન તારીખ ૩૧મી-ડિસેમ્બર-૨૦૨૦ના રોજ અથવા તે પહેલાં ફાઇલ કરવા માટેની જાણ સૂચિત કરવામાં આવેલ છે.

આ સંદર્ભમાં આદેશનો મુસદ્દો આયોગની વેબસાઇટ (www.gercin.org) ઉપર તા: ૨૧-૧૨-૨૦૨૦ના રોજ અથવા તે પહેલાં રસ ધરાવનાર વ્યક્તિઓ પાસેથી સૂચનો મેળવવા હેતુસર મૂકવામાં આવેલ છે.

આ સાથે સૂચિત કરવામાં આવે છે કે જે વ્યક્તિઓ આદેશ ના મુસદ્દા અંગે પોતાના ટિપ્પણીઓ કરવા રુચિ ધરાવે છે, તેઓએ તેમની ટિપ્પણીઓ આનુષંગિક દસ્તાવેજની (જો કોઈ હોય તો) સાથે efiling@gercin.org પર મોકલી અથવા તો તે સચિવ શ્રી, ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ, છઠ્ઠો માળ, ગિફ્ટ-૧ ટાવર, રોડ-૫-સી, ઝોન-૫, ગિફ્ટ સિટી, ગાંધીનગર-૩૮૨૩૫૫ પર મોકલી ને રજૂ કરી શકે છે. નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે સમયસર પ્રશુલ્ક આદેશ આપવાની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને, આયોગ દ્વારા આદેશ ના મુસદ્દા પર સૂચનો/વાંધાઓ ધ્યાને લઈ વહેલી તકે આખરી આદેશ અપાશે.

સહિ/-

સચિવ

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ
ગાંધીનગર, ગુજરાત

સ્થળ : ગાંધીનગર
તારીખ: ૦૫/૧૨/૨૦૨૦

